

ચીની નવવર્ષ ૨૦૧૯ : વરાહ (ડુક્કર)નું વર્ષ

ગુંગનું અને ઓશ્કિ

ચીની નવવર્ષ ૨૦૧૯ના સન્માનમાં

ચીની રાશિયક, બાર વર્ષીય ચક પર આધારિત છે, જેમાં દરેક વર્ષ એક વિશિષ્ટ પણું સાથે જોડાયેલું છે. એવું માનવામાં આવે છે કે એ વર્ષ અને તે વર્ષમાં જન્મેલાં લોકો બંનેમાં જે તે વર્ષના પણું ગુણ જોવા મળે છે.

આ વર્ષે, ચાંદતિથિ અનુસાર, ચીની નવવર્ષની શકૃઆત મંગળવાર, ૫ ફેબ્રુઆરીથી થાય છે. આ દિવસ વરાહના (ડુક્કરના) વર્ષના આરંભનું સૂચક છે, જે રાશિના બાર-વર્ષીયચકનું બારમું ચિહ્ન છે. એવું કહેવાય છે કે વરાહના (ડુક્કરના) વર્ષમાં જન્મેલાં લોકો ઉદાર, મિલનસાર, વિશ્વાસપાત્ર અને નિખાલસ હોય છે.

* * *

ધારણાં વર્ષોં પહેલાંની વાત છે, ઉત્તર અમેરિકાના વિશાળ સરોવરના કિનારે બે નાનાં ડુક્કર ખાવાનું શોધી રહ્યાં હતાં. આ બંને ડુક્કરો ભાઈ-ભાઈ હતાં, એ સમયે તેઓ હજુ નાનાં બચ્ચાં હતાં, અને થોડાં દુર્બળ હોવા છતાં સાચે જ ખૂબ સુંદર હતાં.

તે ભૂખ્યાં હોવાં છતાં મસ્તીથી આમતેમ ઊછળ-કૂદ કરતાં રહેતાં. તે ધૂળમાં આળોટતાં, ઓંક-ઓંક અવાજ કરતાં, તેમનાં ગુલાબી નાકથી એકબીજાને ઘક્કો મારતાં અને તેમની ચારેબાજુ ધાસનાં ઝૂમખાંને દ્યાનથી જોતાં. તેમાંના થોડાં છોડ ખરેખર ખાવા લાયક હતા.

જ્યારે તેમને એક લીલોછિમ ભાગ દેખાયો જે બહુ મજેદાર હતો ત્યારે જ ક્યાંક દૂરથી એક વિચિત્ર અવાજ સંભળાયો. ખટ્ટ. ખટ્ટ. ખટ્ટ. ડુક્કર થોબી ગયાં અને આમતેમ જોવાં લાગ્યાં. તે શું હશે?

ખટ્ટ. ખટ્ટ. ખટ્ટ. ફરીથી તે જ અવાજ સંભળાયો અને લાગતું હતું કે તે અવાજ મોટો ને મોટો થઈ રહ્યો છે. તે બંને ડુક્કર દોડીને ધાસ પાછળ બની રકે તેટલું નીચે નમીને સંતાઈ ગયાં. તેઓ આંખો પહોળી કરીને એકબીજાને જોવાં લાગ્યાં.

અને પછી — કંઈ જ નહીં. એકદમ શાંતિ.

મોટું દુક્કર સાવચેતીથી એક પગલું ભરીને આગળ ગયું. તેણે ધાસમાં પોતાના નાકને થોડુંક આગળ કર્યું કે અચાનક જ એક અવાજ સંભળાયો. એક મોટી લાકડી તેના તરફ આવી રહી હતી. તેણે ચીસ પાડી અને પાછળ તેના ભાઈ પર પડી ગયું.

જ્યારે એ દુક્કરો મુશ્કેલીથી ઊભા થઈ રહ્યાં હતાં ત્યારે તેમણે જોયું કે બે મોટી ચમકતી આંખો ધ્યાનથી તે બંનેને જોઈ રહી હતી. થોડીવારમાં જ તેમને સ્પષ્ટતાથી એક વૃદ્ધ મહિલાનો ચહેરો દેખાવા લાગ્યો. એમ લાગતું હતું કે તેના ચહેરા પરની કરચલીઓ તેમની ઉંમરની સાથે-સાથે દ્વારાળુતાને પણ દર્શાવી રહી હતી. તેના હાથમાં એક કાળી ટોપલી હતી જે પાઈનવૃક્ષનાં પાંદાંઓથી આખી ભરેલી હતી.

પોતાની લાકડીના ટેકાથી આગળ નમીને તે વૃદ્ધાએ પૂછ્યું, “અરે! તમે કોણ છો? શું તમે નાનાં બચ્યાં અહીં એકલાં જ છો?”

આ દુક્કરનાં બચ્યાં આંખો પટપટાવીને તેને જોવાં લાગ્યાં. તે વૃદ્ધાએ આજુભાજુ નજર દોડાવી; પણ તેને આ દુક્કરોની મા દેખાઈ નહીં.

“તો, ચાલો — મારી ટોપલીમાં આવી જાઓ. તમને જોઈને લાગે છે કે તમે ભૂખ્યાં છો. હું તમને નજીકના શોબિટાઉન ગામમાં આવેલાં મારા ધરે લઈ જઈશા, અને મારાથી બની શકે એટલી સારી રીતે તમારું પાલન-પોષણ કરીશા.”

તેનો અવાજ મૂઢુલ અને આશ્વાસન આપે એવો હતો. દુક્કરો આતુરતાથી તે વૃદ્ધા તરફ આગળ વધ્યાં. તેણે તે બચ્યાંના માથા પર હાથ ફેરવતાં ફેરવતાં ફરીથી કહ્યું, “આવો.” તેણે હળવેથી બંને દુક્કરને ઉપાડીને ભેગા કરેલાં પાઈનવૃક્ષનાં પાંદાં પર મૂક્યાં અને પછી તેઓ બધાં શોબિટાઉન તરફ ચાલ્યાં ગયાં.

એ વૃદ્ધા ટોપલીને પોતાના હાથમાં ઝૂલાવતી-ઝૂલાવતી ચાલી રહી હતી. તે ઘણાં વર્ષોથી એકલી રહેતી હતી, અને ભલે તે તેના એકલતાભર્યા જીવનથી ટેવાઈ ગઈ હતી પણ અંતરના ઊંડાણમાં તે દુઃખી રહેતી હતી. તેને કોઈકના સાથની તીવ્ર ઈચ્છા હતી. જ્યારે તેણે તે બે દુક્કર તરફ જોયું ત્યારે તેને લાયું કે તેના હદ્યમાં કોઈક લાગણી ઉભરાઈ રહી છે, તેના અંતરના તે ખૂણાઓ જે ઘણા લાંબા સમયથી સૂના-સૂના અને તરછોડાયેલા લાગી રહ્યા હતા તેમાં પ્રેમ છવાઈ રહ્યો હતો. તે ફક્ત એ બચ્યાંઓ માટે સ્વાદિષ્ટ ગરમા-ગરમ ભોજન બનાવવા માંગતી હતી.

જ્યારે તેઓ તે જ્યાં રહેતી હતી એ ઝૂંપડીમાં પહોંચ્યા ત્યારે તેણે તેમ જ કર્યું. તેણે તે દુક્કરો માટે મકાઈની રાબ બનાવી અને બચ્યાંઓ અધીરાઈથી તેને ચાટતા હતાં તે જોવા લાગી અને તેમના આનંદપૂર્ણ અવાજથી તેનું ધર ભરાઈ ગયું. જ્યારે બચ્યાંઓએ જ મી લીધું, ત્યારે તેણે ધાસની પથારી બનાવી અને ધીમેથી ગાઈને તેમને સૂવડાવી દીધાં.

બીજા દિવસે સવારે, વૃદ્ધ મહિલા બહાર બેસીને દુક્કરોને ઝૂંપડીની પાસે આવેલાં ખુલ્લાં ખેતરમાં આમતેમ ફરતાં જોઈ રહી હતી. સૂર્યના ઝાખાં કિરણો ધાસ પર પડી રહ્યાં હતાં અને દુક્કરો તે કિરણોની હુંક લઈ રહ્યાં હતાં. એ

વૃદ્ધા થોડીવાર સુધી તેમને જોતી રહી, તેના ચહેરા પર એક નાનું સિમિત આવી ગયું. ત્યારે તેનું ધ્યાન ગયું : તેણે હજુ સુધી તેમનું નામ જ નથી પાડ્યું!

જુદાજુદા નામો વિચાર્યા પછી તેમણે નક્કી કર્યું. તેમનાં નામ હશે — ઝૂંગન્ અને ઓષ્ઠિ.

* * *

આ વૃદ્ધાની દેખરેખમાં દુક્કરો જઈથી મોટાં થઈ ગયાં. તે સશક્ત અને તંદુરસ્ત થઈ ગયાં અને તેમનો ભિજાજ પહેલાંની જેમ પ્રેમાળ જ રહ્યો. ખાસ કરીને ઝૂંગન્માં કોઈ વિશેષ વાત હતી. કોઈક વાર તે વૃદ્ધાને લાગતું કે ઝૂંગન્ જેટલું બહાર બતાવતો હતો તેનાથી પણ વધારે સમજતો હતો.

ઝૂંગન્ અને ઓષ્ઠિ તેની સાથે રહેવાં આવ્યાં તેના લગભગ છ મહિના પછી, એક દિવસ ગામમાં એક મોટો બોજન સમારોહ હતો. એ વૃદ્ધા માટે તે સમારોહ ઘણો ઘોંધાટવાળો હતો તેથી તેણે ભાગ ન લીધો પણ ગામનાં લોકો તેને મળવાં આવ્યાં અને તેને માટે થોડું બોજન પણ લાવ્યાં હતાં.

તેથી જ્યારે બપોર પછી ત્રણ મોટા મજબૂત બાંધાના પુરુષો તેના દરવાજા પર આવ્યા ત્યારે તે વૃદ્ધાએ કંઈ વધારે વિચાર્યું નહીં.

તેમાંના એક પુરુષે આગળ આવીને કહ્યું. “નોકોમિસ્ એટલે કે દાઢીમા, અહીંથી પસાર થતી વખતે અમે તમારાં દુક્કરને જોયાં વગર ન રહી શક્યાં. તે કેટલાં તંદુરસ્ત દેખાય છે! કેટલાં ખુશ છે! શું તમે જ તેમને મોટાં કર્યાં છે?”

એ વૃદ્ધા ખોટાં વખાણ સાંભળીને ખુશ થઈ ગઈ.

તેણે કહ્યું, “આવું કહેવા માટે તમારો ખૂબ-ખૂબ આભાર. હા, મેં જ તેમને નાનાં હતાં ત્યારથી મોટાં કર્યાં છે.” અને તેણે ઝૂંપડીની બહાર ઊભેલાં ઝૂંગન્ તરફ આંગળી ચીંધીને કહ્યું “પેલો મોટો દેખાય છે તે ઝૂંગન્ છે. અને તેનો નાનો ભાઈ, જે તમને હમણાં દેખાશો, ખેતરમાંથી આવી રહ્યો છે તે ઓષ્ઠિ છે.”

“સાચે જ, તેમની સારસંભાળ લઈને તમે બહુ સારું કામ કર્યું છે. અમે ક્યારેય આટલાં સુંદર દુક્કર જોયાં નથી.” એ માણસે પોતાના મિત્ર સામે જોઈને કહ્યું, જેણે હકારમાં માથું હલાવ્યું. “હવે તે બંને પૂરીરીતે મોટાં થઈ ગયા હશે, ખરું ને?”

વૃદ્ધ મહિલાએ જવાબ આપ્યો, “અરે, હા, જ્યારે તે બંને મને પહેલીવાર મળ્યાં હતાં ત્યારે તમારે તેમને જોવા જોઈતાં હતાં. એકદમ પાતળાં, એકદમ નાનાં! જેકે મેં તેમને સારી રીતે જડાં કરી દીધાં છે. હા, હું કહીશ કે તે બહુ સારી રીતે મોટાં થઈ ગયાં છે.”

તે માણસે થોડા વિચલિત થઈને કહ્યું, “નિશિન્ — સરસ, સરસ.” તેની આંખો ઝૂંગન્ પર હતી.

તે પેલી મહિલા તરફ પાછો ફરીને બોલ્યો, “નોકોમિસ, શું તમે અમારી સાથે તમાકુ નહીં ખાઓ? આજે ભોજન સમારોહ છે અને તમને થોડી તમાકુ આપવી એ અમારા માટે સન્માનની વાત હશે.”

એ મહિલાએ આનંદથી તે સ્વીકારી લીધું. તેમના ગામમાં કોઈને તમાકુ આપવી એ એક પવિત્ર રિવાજ હતો. તદુપરાંત, આ માણસો ઘણા સભ્ય લાગતા હતા. તે તેના મહેમાનોને ઝૂંપડીમાં લઈ ગઈ અને તેમને બેસવા માટે કહ્યું.

થોડી મિનિટ પછી તેમાંના એક માણસે કહ્યું, “નોકોમિસ, તમારી પાસે ખરેખર ઘણા સુંદર દુક્કરો છે.”

એ મહિલાએ તેની સામે ફરી જોયું. કોઈક કારણસર તેને એ માણસનો ચહેરો ઓળખાયો નહીં — તેને આંખોથી ઝાંખુ હેખાવા લાગ્યું. અચાનક જ તેનું મગજ ભ્રમિત થઈ ગયું. જો તે આ પરિસ્થિતિને વધારે સારીરીતે સમજ શકી હોત તો તેને ખર્બર પડી ગઈ હોત કે તેમણે આપેલા તમાકુમાં કંઈક ગરબદ હતી — કે તેમાં કોઈ પ્રકારનું માદક દ્વય મેળવેલું હતું, કે હકીકતમાં આ માણસોનો ઈરાહો સારો નહોતો.

પરંતુ, આવું કોઈ વિશ્લેષણ કરવાની વિચારશક્તિ તેનામાં નહોતી રહી.

“હમ્?” તે માત્ર આટલું જો બોલી શકી.

“તારા દુક્કરો, નોકોમિસ્.”

ત્યાંસુધીમાં તો વૃદ્ધાની આંખો બંધ થઈ ગઈ હતી. તે મનમાં ને મનમાં હસી રહી હતી. આખરે, એમ લાગ્યું કે તેણે બોલવા માટે મૌં બોલ્યું, પણ તેણે તો ગાવાનું શરૂ કરી હીધું અને તે પણ એકદમ બેસૂરા રાગમાં. “સારું છે, સારું છે, બધું જ સારું છે...” તે બેદ્યાનપણે ગાવા લાગી.

તે માણસને તક મળી ગઈ. “નોકોમિસ, મહેરબાની કરીને શું તમે તમારાં દુક્કરમાંના એક દુક્કરને અમને વેચશો?”

તે મહિલા માત્ર ગાતી જ રહી. “સારું છે, સારું છે, તે ઘણું સારું છે...”

તે માણસે પૂછ્યું, “શું તમારા નાના દુક્કરને વેચશો?” તે પોતાના નસીબને વધુ અજમાવવા નહોતો માંગતો, કદાચ એ વૃદ્ધા હોશમાં આવી જય તો!

“સારું છે, સારું છે, તે બધું ઘણું સારું છે...”

“બહુ સરસ. શું તમે જઈને તેને લઈ આવશો?” તે માણસે પૂછ્યું. તેણે તેનો હાથ લંબાવ્યો.

તે મહિલા હજુપણ પોતાની અર્ધ-ચેતન અવસ્થામાં, પેલાં માણસનો હાથ પકડીને લથડિયાં ખાતાં ખાતાં પોતાના પગ પર ઊભી થઈ. તે માણસ તેને ઝૂંપડીના હરવાજ સુધી લઈ ગયો, જ્યાં એ મહિલાએ ગાતાં ગાતાં કહ્યું,

“ઓઝી! ઓઝી! અહીં આવ!”

હવે બન્યું એવું કે દુક્કરો થોડીલારથી જૂંપડીની બાજુમાં ધાસમાં જ સંતાયેલાં હતાં. તેમણે આ માણસો અને વૃદ્ધ મહિલા વર્ચ્યેનો આખો વાર્તાલાપ સાંભળી લીધો હતો અને તેમના દરેક શબ્દ સાંભળીને તેમની આંખો પહોળી થઈ રહી હતી. જ્યારે વૃદ્ધ મહિલાએ બૂમ પાડીને ઓઝિને બોલાવ્યો ત્યારે તે પોતાના ભાઈ સામે જોવા લાગ્યો, તેની આંખોમાં ડર હતો.

“ભાઈ, અહીં આવેલા આ લોકો વિચિત્ર છે. હું નથી ઇચ્છિતો કે તેઓ મને અહીંથી લઈ જય. મને આમાં કંઈક ખતરો લાગે છે.” ઓઝિનું મોં ડરથી ધ્રુજવા લાગ્યું.

જૂંગને પ્રેમથી પોતાનું માથું તેના ભાઈના માથા સાથે ઘસ્યું અને ખૂબ જ કોમળતાથી કહ્યું :

“ઓઝિ, મને ઘણું દુઃખ થાય છે. ભલે હું ગમે તેટલું ઇચ્છું, પરંતુ તારું ભાય નહીં બદલી શકું. તેમ છતાં હું એટલું જ કહી શકીશ : તું જ્યાં પણ જય, તારી સાથે જે કંઈ પણ થાય, તું સરોવરમાં સ્નાન કરવાનું યાદ રાખજો. એ સરોવરમાં સ્નાન કરજો અને તને સીડર અતાર જેવી સુગંધ આવશે, એક એવી સુગંધ જે ક્યારેય લુસ નહીં થાય.”

જ્યારે જૂંગને આ કહ્યું ત્યારે પણ વૃદ્ધ મહિલા જૂંપડીના દરવાજે ઊભી હતી. તેનો નશો ઉત્તરી રહ્યો હતો. જ્યારે તેણે પોતાના દુક્કરના શબ્દો સાંભળ્યાં, તો એ શબ્દોથી તેનું હદ્ય બેદાઈ ગયું.

તે મહિલાએ તેની જૂંપડીમાં એ માણસો તરફ જોયું, તેની આંખો આંસુથી ચમકી રહી હતી. તે માણસોએ તેની તરફ જોયું, તેમના ભવાં સંકોચાઈ ગયા હતા અને તેમનું મોં પડી ગયું હતું. તેમણે પણ જૂંગનના શબ્દો સાંભળી લીધા હતા. એક દુક્કર, રહસ્યમય અને વિરોધાભાસી વાતો કરે છે! તેને શું સમજવું?

“મહેરબાની કરીને ચાત્યા જાઓ,” એ વૃદ્ધ મહિલાએ કડક અવાજમાં કહ્યું. “મારાં દુક્કર તમને કે બીજાં કોઈને વેચવા માટે નથી.”

તે માણસે કોઈ વિરોધ કર્યો નહીં. તેમણે ધીમા અવાજમાં માફી માંગી અને હવે તો તેમણે રસ્તો પકડવાની જ જરૂર છે એવું પણ બબડયા. તેમણે બબડાટ કરતાંકરતાં જતાં પહેલાં એક છેલ્લીવાર એ મહિલા અને તેનાં દુક્કરો તરફ આશ્ર્ય ભરી નજરે જોઈ લીધું.

ગામમાં વાયુવેગે વાત ફેલાઈ ગઈ, અને થોડા સમયમાં જ ગામના મુખીએ જે પણ થયું તે વાત સાંભળી. કુતૂહલતાપૂર્વક તેણો એ વૃદ્ધ મહિલા અને તેનાં દુક્કરોને પોતાની જૂંપડીમાં બોલાવ્યાં જ્યાં તે પોતાના પરિવાર સાથે રહેતો હતો.

તેણે વિનયપૂર્વક તેમનું સ્વાગત કર્યું અને તેમને જત-જાતનું ભોજન કરાવ્યું અને પોતાના મનમાં જે હતું તે કહ્યું. “જૂંગન્ન, મૈં સાંભળ્યું છે કે હાલમાં તે મહાન જ્ઞાનની વાત કહી હતી. પરંતુ તે જે કહ્યું તે મને ઘણું રહસ્યમય લાગ્યું. ‘સરોવરમાં સ્નાન કરજો અને એવી સુગંધ મેળવી લેજો જે ક્યારેય લુસ ન થાય.’ તેનો શું અર્થ છે?”

જૂંગને મુખી તરફ સ્થિત કર્યું અને કહ્યું : “સરોવર એ પ્રેમ છે, અને પ્રેમ જ એ સુગંધ છે જે કદાપિ લુસ નથી થતી. હું મારા નાના ભાઈને કહી રહ્યો હતો કે ભલે તેનો દુનિયા છોડવાનો સમય આવ્યો હોય તો પણ દુઃખી થવું

નહીં. આપણે નોકોમિસની સાથે કેટલું સરસ જીવન જીવ્યાં છે; તેણે અમને બતાવ્યું કે પ્રેમ શું છે. હું ઓઝિને સમજાવવા માંગતો હતો કે ભલે શરીરનો નાશ થઈ જાય, પરંતુ આ પ્રેમ, જેને અમે ઓળખી લીધો છે — આ પ્રેમ જેણે આપણને ઘેરી લીધા છે અને જે આપણા અંતરમાં છે, જે આપણું પોતાનું સત્ત્વ છે અને બધી વસ્તુઓ સાથેનું આપણું અનુસંધાન છે — તેનો નાશ થઈ શકે નહીં.”

મુખી થોડી ક્ષાળ માટે ચૂપ થઈ ગયો અને પછી તેણે પ્રશંસામાં પોતાનું માથું એક વાર, બે વાર, ત્રણ વાર હલાવ્યું. તેણે કહ્યું, “જુંગન્દુ, તું સાથે જ જ્ઞાની છે. અને હું માત્ર એટલું જ વિચારી શકું છું કે ગામના પ્રક્રિયા માટે તારા જેવો સલાહકાર અતિ મૂલ્યવાન રહેશે. શું કૃપા કરીને તું મારા પરિવારમાં આવીને મારા નાના ધરમાં અમારી સાથે રહીશા? વાસ્તવમાં તમારે બધાંએ અમારી સાથે રહેવું જોઈએ — જે તારો ભાઈ અને નોકોમિસ પણ અહીં રહેવા માટે આવે તો એ મારા માટે ધણાં સન્માનની વાત હશે.”

અને એમ જ થયું. બંને દુક્કર અને દ્વારાણું વૃદ્ધ મહિલા જે તેમને તેનાં ધરે લઈ આવી હતી, તેમણે બાકીનું જીવન મુખી અને તેના પરિવાર સાથે વીતાવ્યું. તેઓ આરામથી જીવ્યાં અને ઉદ્દેશ્યપૂર્ણ જીવન જીવ્યાં — તેમના સંપર્કમાં આવનારાં બધાં લોકો માટે તેમની દ્વારાણુતા અને પ્રજ્ઞાન, તેમની વિનાન્તરાના અને આસ્થા એક ઉદાહરણ અને પ્રેરણા બની ગઈ હતી.



© ૨૦૧૬ એસ.વાય.ડી.એ. ફાઉન્ડેશન®. સર્વાધિકાર સુરક્ષિત.

ઇશા સરહેસાઈ દ્વારા પુનર્લિખિત

આ વાતાની પ્રેરણા એક જાતક કથામાંથી મળી છે — ભગવાન બુદ્ધના વિભિન્ન અવતારો વિશે બોધકથાઓ અને દણાંત કથાઓના સંગ્રહમાંથી.